

ત્વરિત જાહેરાત માટે

## સીટીએ મે 31 થી જૂન 6, 20 સુધી નેશનલ એક્સેસ-એબિલિટી વીક ઉજવ્યું

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (જૂન 4, 2020) – સીટી ઓફ બ્રેમ્પટને જૂન 6 સુધી નેશનલ એક્સેસ-એબિલિટી વીક ઉજવ્યું. નેશનલ એક્સેસ-એબિલિટી વીક અશક્તતા ધરાવતા કેનેડિયનોના મૂલ્યવાન ફાળાને ઉજવે છે, અને પ્રવેશ સુલભતા અને સમાવેશ યોગ્યતામાં અવરોધો દૂર કરવા કાર્યરત વ્યક્તિઓ, સમુદાયો અને કાર્યસ્થળોને ઓળખ આપે છે.

સીટી ઓફ બ્રેમ્પટન અને તેની [એક્સેસિબિલિટી એડવાઈઝરી કમિટી](#) બંધી ઉંમરની અને ક્ષમતાઓ ધરાવતા લોકો પોતે બ્રેમ્પટનમાં રહે, કામ કરે, રમતો રમે, મુલાકાત લે અને રોકાણ કરે ત્યારે તેઓ સરખી તકોનો આનંદ માણી શકતી હોવાની ખાતરી કરાવવા કટિબદ્ધ છે. એક્સેસિબિલિટી એડવાઈઝરી કમિટી અશક્તતા ધરાવતી વ્યક્તિઓના મુદ્દાઓ અને ચિંતાઓ ઉઠાવવા એક મંચ (ફોરમ) પૂરું પાડે છે. તે સીટીના કાર્યક્રમો, કાર્યનીતિઓ અને વ્યવહારો સંબંધિત બાબતો પર બ્રેમ્પટન સીટી કાઉન્સિલને સલાહ અને માર્ગદર્શન પણ પૂરું પાડે છે.

COVID-19 મહામારી દરમિયાન, સીટીએ સીનિયર્સ અને સોશિયલ સપોર્ટ ટાસ્ક ફોર્સિસ મારફતે અશક્તતા ધરાવતા રહેવાસીઓને સહાયતા પૂરી પાડવાનું ચાલુ રાખ્યું છે. આ સહાયતામાં કરિયાણું ખરીદી, ખાદ્યપદાર્થો સુધી પહોંચ અને વૈકલ્પિક સ્વરૂપોમાં માહિતી પૂરી પાડવાનું સામેલ છે. એક્સેસિબિલિટી સંસાધનો માટે અને સીટીનું કોઈ પ્રકાશિત કે ઓનલાઈન સાહિત્ય [વૈકલ્પિક સ્વરૂપો](#)માં મેળવવા માટે વેબસાઈટ જુઓ, [www.brampton.ca](http://www.brampton.ca).

### રિક હેન્સન ફાઉન્ડેશન એક્સેસિબિલિટી સર્ટિફિકેશન રેટિંગ

માર્ચમાં, સીટીએ ઘોષણા કરી કે ઓન્ટેરિયોમાં બ્રેમ્પટનને દસમાંની એક મ્યુનિસિપાલિટી તરીકે પસંદ કરવામાં આવી હતી જ્યાં સ્થાનિક સંસ્થાઓ એક શુભેચ્છારૂપી (મફત) રિક હેન્સન ફાઉન્ડેશન એક્સેસિબિલિટી સર્ટિફિકેશન (RHFA) મેળવવા અરજી કરી શકે છે, જે કાર્યક્રમ અશક્તતા ધરાવતા લોકો માટે ઈમારતો કેટલી પ્રવેશયોગ્ય છે તેનું રેટિંગ કરે છે.

બ્રેમ્પટનમાં નફો ન રળનારી, જાહેર અને ખાનગી સંસ્થાઓને મફત RHFA રેટિંગનો લાભ લેવા પ્રોત્સાહિત કરવામાં આવે છે જેથી તેઓ પોતાની ઈમારતોનું પ્રવેશયોગ્ય સ્તર વધારે સારી રીતે સમજી શકે અને સુધારાઓ કરવાની રીતો ઓળખી શકે. ઉચ્ચ કક્ષાનું પૂરતું રેટિંગ મેળવતી ઈમારતો રિક હેન્સન ફાઉન્ડેશન એક્સેસિબિલિટી સર્ટિફિકેશન અથવા એક્સેસિબિલિટી સર્ટિફિકેશન ગોલ્ડ બનશે.

નવા શુભેચ્છારૂપી RHFA કાર્યક્રમને ગવર્નમેન્ટ ઓફ ઓન્ટેરિયોની સાથે રિક હેન્સન ફાઉન્ડેશનની ભાગીદારીમાં સમુદાયોને વધારે પહોંચયોગ્ય બનાવવાના લક્ષ્ય સાથે ભંડોળ આપવામાં આવે છે. બ્રેમ્પટનને પોતાની વસ્તીનું કદ અને ભૌગોલિક વિવિધતા માટે પસંદ કરવામાં આવ્યું હતું. સમગ્ર બ્રેમ્પટનમાં આશરે 25 સ્થળો શુભેચ્છારૂપી RHFA રેટિંગ્સ મેળવવાને પાત્ર બનશે. સંસ્થાઓ આ વેબસાઈટ પર અરજી કરવી રહી, [www.rickhansen.com/freerating](http://www.rickhansen.com/freerating).

RHFA કાર્યક્રમ પર વધુ માહિતી મેળવવા વેબસાઈટ જુઓ, [www.brampton.ca](http://www.brampton.ca)

### એક્સેસિબિલિટી (પ્રવેશ સુલભતા) એવોર્ડ્સ

એક્સેસિબિલિટી એવોર્ડ્સ એક નાગરિક ઓળખ અપાવનારો કાર્યક્રમ છે જે બ્રેમ્પટનમાં અશક્તતા ધરાવતા લોકો માટે પ્રવેશ સુલભતા અને સમાવેશ યોગ્યતામાં કટિબદ્ધતા દર્શાવતી વ્યક્તિઓ, સમુદાયો અને સંસ્થાઓને ઓળખ આપે છે.

વર્ષ 2020 નાં એક્સેસિબિલિટી એવોર્ડ્સ માટેના નામાંકનો સપ્ટેમ્બરમાં ખુલશે. રહેવાસીઓને વધુ માહિતી માટે અને એક ઓનલાઈન નોમિનેશન ફોર્મ માટે ફોલોમાં (પાનાખર ઋતુમાં) સીટીની વેબસાઈટ જોવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. વર્ષ 2019 નાં એવોર્ડ વિજેતાઓ [અહીં](#) જોઈ શકાય છે.

એવોર્ડ્સ ડિસેમ્બરમાં બ્રેમ્પટન સીટી હોલમાં આપવામાં આવશે.

### અવતરણો (ક્વોટ્સ)

“બ્રેમ્પટન એક મોઝેઈક છે અને સીટી અશક્તતા ધરાવતા લોકો માટે અવરોધો હટાવવા અને આપણાં સમગ્ર વૈવિધ્ય સમુદાયમાં પ્રવેશ સુલભતા વધારવા કટિબદ્ધ છે. હું તમામ બ્રેમ્પટનવાસીઓને નેશનલ એક્સેસ-એબિલિટી વીકને ઓળખ આપવામાં અમારી સાથે જોડાઈ જવા, અને બ્રેમ્પટન અને કેનેડાને પ્રવેશ સુલભ અને તમામ માટે સમાવેશ યોગ્ય બનાવવા કાર્યરત આપણાં સમગ્ર દેશવાસીઓના પ્રયત્નોને ઉજવવા પ્રોત્સાહિત કરું છું.”

- પેટ્રિક બ્રાઉન (Patrick Brown), મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

“સીટી ઓફ બ્રેમ્પટન અને રીજીયન ઓફ પીલ્સ એક્સેસિબિલિટી એડવાઈઝરી કમિટીસના સભ્ય તરીકે, આપણાં સભ્યો દ્વારા બ્રેમ્પટનને બધી ક્ષમતાઓ ધરાવતા લોકો માટે પ્રવેશ સુલભ અને સમાવેશ યોગ્ય બનાવવા કરવામાં આવતી કામગીરી માટે મને ગૌરવ છે. આ નેશનલ એક્સેસ-એબિલિટી વીક દરમિયાન, અશક્તતા ધરાવતા આપણાં સાથી કેનેડિયનોનો મૂલ્યવાન ફાળો ઉજવવા, અને બ્રેમ્પટન અને દેશભરમાં લોકો, સમુદાયો અને કાર્યસ્થળોને ઓળખવા હું દરેક વ્યક્તિને વિનંતી કરું છું. ચાલો આપણે પ્રવેશ સુલભતા અને સમાવેશ યોગ્યતાના અવરોધો હટાવવા કાર્યરત લોકોનો સ્વીકાર કરીએ.”

- પેટ ફોર્ટિની (Pat Fortini), પ્રાદેશિક કાઉન્સિલર, વોર્ડ્સ 7 અને 8; સભ્ય, સીટી ઓફ બ્રેમ્પટન એક્સેસિબિલિટી એડવાઈઝરી કમિટી; સભ્ય, રીજીયન ઓફ પીલ એક્સેસિબિલિટી એડવાઈઝરી કમિટી

“શહેરમાં, બધી ઉંમરના અને ક્ષમતાઓ ધરાવતા લોકો બ્રેમ્પટનમાં એક્સરખી તકોનો આનંદ માણે અને બધાં લોકો માટે સમાવેશ યોગ્ય અને લચીલી જગ્યાઓનું નિર્માણ થાય એ ખાતરી કરાવવા અમે સમર્પિત છીએ. હું આપણી સેવાઓ, કાર્યક્રમો અને સગવડો બધાં માટે પ્રવેશ સુલભ બનાવવા સમગ્ર સંસ્થાના કર્મચારીઓનો અને તેઓ સાથે આ નેશનલ એક્સેસ-એબિલિટી વીકને ઓળખ આપવામાં જોડાઈ જવા બદલ આભાર માનું છું.”

- ડેવિડ બારિક (David Barrick), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સીટી ઓફ બ્રેમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તેમાં 70,000 વ્યવસાયો છે. અમે જે કરી કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. અહીં વધુ જાણકારી મેળવો [www.brampton.ca](http://www.brampton.ca).

**मिडिया संपर्क :**

मोनिका दुग्गल (Monika Duggal)

कोऑर्डिनेटर, मिडिया अन्ड कम्युनिटी एंगेजमेन्ट

व्यूडात्मक संवाद

सीटी ओफ़ ब्राम्पटन

905-874-3426 | [Monika.Duggal@brampton.ca](mailto:Monika.Duggal@brampton.ca)